

(Formerly known as Gopala Polyplast Limited)

Date:-03-09-2022

To,
The General Manager,
Department of Corporate Services,
BSE Limited
Listing Department
Phiroze Jeejeeboy Tower,
Dalal Street,
Fort Mumbai-400 001

Scrip Code: 526717

Sub:- Newspaper Advertisement -Intimation of 38th Annual General Meeting of the company through Video-Conferencing/ Other Audio Visual Means ("VC/ OAVM") facility.

Dear Sir/Mam,

Pursuant to Regulation 30 read with Schedule III part A para A of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), please find enclosed herewith copy of Newspaper Advertisement published in Financial Express- Ahmedabad Edition (in English) on 3rd September,2022 and Financial Express- Ahmedabad Edition (in Gujarati) on 3rd September,2022 intimating that 38th Annual General Meeting will be held on Monday, 26th September,2022 at 11.00 a.m through VC/OAVM.

The said newspaper advertisement is also available on the company's website www.hpbl.in.

Thanks & Regards,

For HCP Plastene Bulkpack Limited

Dipesh Panchar

VIJAYA DIAGNOSTIC CENTRE LIMITED

CIN: L85195TG2002PLC039075 Corporate Office: No.6-3-883 F, FPA Building, Near Rajiv Gandhi Statute Lane

NOTICE OF 20™ ANNUAL GENERAL MEETING AND INFORMATION OF REMOTE E-VOTING

Notice is hereby given that the Twentieth (20°) Annual General Meeting (AGM) of Vijaya Diagnostic Centre Limited ("Company") will be held on Wednesday, September 28, 2022 at 03.00 p.m.(IST)through Video Conferencing ("VC")/ Other Audio- Visual Means ("OAVM"), in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with relevant circulars issued by Ministry of Corporate Affairs and SEBI, from time to time, to transact the businesses as set out in the Notice convening 20th AGM of the Company ("AGM Notice").

The aforesaid AGM Notice along with the Annual Report of the Company for the Financial Year 2021-22 have been sent only through electronic mode to all the members whose e-mail addresses are registered with the Depository Participants/Company/Registrar and Transfer Agents ('RTA') on September 2, 2022. The AGM Notice and Annual Report are also available on the Company's website www.vijayadiagnostic.com, website of National Stock Exchange of India Limited and BSE Limited at www.nseindia.com and www.bseindia.com respectively and also on the website of e-voting agency, Kfin Technologies Ltd

Members will be able to attend the AGM through VC/OAVM ("e-AGM") by accessing the website of Kfintech at http://emeetings.kfintech.com by using their remote e-voting login credentials. Members participating through VC / OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), 2015, Company is providing facility to the members to cast their votes electronically on all the resolutions set forth in the AGM Notice through electronic voting system ('e-Voting') provided by Kfintech. Further, the facility for voting through electronic voting system will also be made available at the e-AGM.

e-voting at the AGM are provided in the Notice to the 20th AGM. The remote e-votingfacility will be available during the following voting period and no

remote e-voting facility will be available beyond the said date and time. Commencement of remote e-voting 9:00 a.m. on Sunday, September 25, 2022

A Member may participate in the AGM even after exercising his/her vote by remote evoting, but shall not be allowed to vote again in the AGM. Only a person whose name is recorded in the Register of Members or In the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date i.e. September 21, 2022, shall be entitled to avail the facility of remote e-voting or participate & e-vote at the AGM. Once the vote on a resolution is cast by member, he shall not be allowed to change it

Any person, who acquires shares of the Company and becomes a Member of the Notice of the 20th AGM. However, if he/she is already registered for e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

of AGM and e-voting instructions could not be serviced. In such case, member may send an e-mail request at the mail id einward.ris@kfintech.com along with scanned copy of the signed request letter providing the email address, mobile number, self attested PAN copy and Client Master copy in case of electronic folio and share certificate in case of physical folio, for enabling the company to send the Annual report, Notice of AGM and the e-voting instructions along with User id and password, as applicable. Members may follow the suitable steps as indicated in the a-voting instructions in the Notice to cast their vote through remote e-voting voting during the AGM.

For permanent registration of e-mail addresses, the Members holding shares in demat form are requested to update the same with their respective Depository Participant and in case of Members holding shares in physical form are requested to update the same with the RTA by submitting form ISR-1.

sections / e-voting user manual available at KFinTech website for e-voting: https://evoting.kfintech.com or contact Mr. Veeda Raghunath/ Mr. Mhammed Shanoor, Corporate Registry at KFinTech, (Unit: Vijaya Diagnostic Centre Limited), Selenium Tower B. Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500 032 at e-mail at evoting@kfintech.com at phone

will be paid to those members whose names appear on the list of beneficial ownership as furnished by the Depositories on the Record Date i.e., September 21, 2022. Members are requested to update their bank account details with their respective Depository Participants for receipt of dividend payment by the Company.

(formerly known as Vijaya Diagnostic Centre Pvt Ltd)

Date: 02.09.2022 Place: Hyderabad

13 FINANCIAL EXPRESS WWW.FINANCIALEXPRESS.COM

SOUTHERN MAGNESIUM AND CHEMICALS LIMITED

Regd. Off: Deccan Chambers, 5th Floor, 6-3-666/B, Somajiguda, Hyderabad - 500082.

NOTICE OF 36™ ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 36th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 30th September, 2022 at 11:30 a.m. through Video Conferencing (VC) and Other Audio-Video Means (VC/ OAVM) facility, in accordance with General Circular nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021 and 02/2022 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021 and May 5, 2022 respectively, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 issued by Securities and Exchange Board of India (SEBI Circulars) without the physical presence of the Members at a

The Notice of the AGM and the Annual Report for the year 2021-22 including the financial statements for the year ended March 31, 2022 will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depository Participants ("Depository"), in accordance with MCA Circular and SEBI Circular. Members can join and participate in the AGM through VC/OVAM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM, Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Notice of the AGM and the Annual Report will also be available on the Company's website www.southernmagnesium.com and website of the Stock Exchange i.e., BSE Limited at

In this regard, the Members whose email ids for all communications are not registered/ updated with their Depository are hereby requested to register/ update their email ids with respective Depository or with Aarthi Consultants Private Limited (the Company's RTA) by sending a request to the Company's RTA on the email address at info@aarthiconsultants.com with subject line (unit- Southern Magnesium and Chemical

- Folio No./ Client ID and DP-ID: Name of shareholder;
- In case shares are held in Physical form-Scan Copy of Share Certificate;
- Self-attested scanned copy of the PAN card; and
- Self-attested scanned copy of AADHAR Card Notice is further given that the Register of Members and Share Transfer books of the Company will remain closed from Saturday, 24th September, 2022 to Friday, 30th September, 2022 (both days inclusive) for purpose of the 36th AGM. By order of the Board of Directors

Date: 02.09.2022 Place: Hyderabad

UCO BANK

Head Office

Printing & Stationery Deptt.

2, India Exchange Place,

Kolkata-700001

E-Tender Notice

Notice inviting for selection of

reputed Courier Agencies thereto

rate contract for dispatch / delivery

of letters in envelopes / parcels/

boxes etc. Terms and conditions

apply as per RFP/NIT. Last date for

submission of application is

23.09.2022 before 04.00 P.M. For

details visit our Bank's Website:

www.ucobank.com and Bank's

authorized e-Tendering Service

Provider M/s Antares Systems Ltd.

through Website https:/

www.tenderwizard.com/UCOBANK

indianexpress.com

I choose substance

over sensation.

Inform your opinion

with credible journalism.

♦ The Indian EXPRESS

SHALIMAR WIRES INDUSTRIES LIMITED CIN: L74140WB1996PLC081521

Registered Office: 25, Ganesh Chandra Avenue, Kolkata - 700 013

Tel : 91-33-22349308/09/10, Fax: 91-33-2211 6880, email ID : secretarial@shalimarwires.com website: www.shalimarwires.com

NOTICE TO SHAREHOLDERS

NOTICE is hereby given that the 26th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Saturday, the 24th September 2022 at 11.00 AM through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) to transact the business as set out in the Notice dated 10th August, 2022 convening the AGM.

The Notice of the AGM together with Annual Report for the year ended 31st March, 2022 has been sent to the members through electronic mode on 1st September, 2022 and available on the Company's website at www.shalimarwires.com , BSE Ltd's website at www.bseindia.com and also on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdi.com (agency providing e-Voting facility)

Notice is also given that the Register of Members and the Share transfer Register of the Company will remain closed from Monday, 19th September, 2022 to Saturday, 24th September, 2022 (both days inclusive) for the purpose of AGM.

Notice is also hereby given that business as set out in the Notice dated 10th August, 2022 shall be transacted through voting by electronic means. The remove e-voting period shall commence on Wednesday, the 21st September, 2022 (9:00 a.m.) and ends on Friday, the 23rd September 2022 (5:00 p.m.). The remote e-voting shall not be allowed beyond the said date and time Members holding shares either in physical or dematerialized form at the close of business hours as on the cut-off date i.e. 17th September, 2022 shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM. Any person who becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date, may obtain the login credentials by sending a request at evoting@nsdl.co.in

Those members who attend the AGM through VC/OAVM and had not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote during the AGM using the e-voting platform provided by NSDL. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again. The detailed procedure and instruction for remote e-voting and e-voting during the AGM is given in the Notice of the AGM.

In case of any query/ grievance connected with remote e-voting, members may refer to the Frequently Asked Questions (FAQ) for shareholders and Remote e-voting User Manual for shareholder available under the download section of www.evoting.nsdl.com or call on the toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL at email ID: evoting@nsdl.co.in

> By Order of the Board For Shalimar Wires Industries Ltd.

Place: Kolkata Date: 2nd September, 2022

S.K. Keiriwal Company Secretary

Genus energizing lives

N. Rajender Prasad

Jt. Managing Director & CFO

(DIN: 00145659)

GENUS PAPER & BOARDS LIMITED CIN: L21098UP2012PLC048300

 Regd. Office: Vill. Aghwanpur, Kanth Road, Moradabad-244001, Uttar Pradesh
 Ph.: 0591-2511242, |
 E-mail: cs@genuspaper.com |
 Website: www.genuspaper.com, Notice of Annual General Meeting and E-Voting Information

Notice is hereby given that the 11th Annual General Meeting ("AGM") of the Members of Genus Paper & Boards Limited ("the Company") is scheduled to be held on Tuesday, September 27, 2022 at 11:30 a.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with the applicable circulars issued by the Ministry of Corporate Affairs and the SEBI in this regard (Collectively referred to as "applicable circulars") to transact the business as set forth in the Notice of AGM. The Members can join the AGM in the VC/OAVM mode 15 minutes before and after the scheduled time of the commencement of AGM by following the procedure mentioned in the Notice of AGM. In accordance with the applicable circulars, the Notice of AGM and Annual Report for the financial year 2021-22 have been sent on September 02, 2022 to all the Members of the Company whose email addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid documents are also available on website of the Company at www.genuspaper.com, website of the Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com and website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com respectively.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI Listing Regulations, and applicable circulars, members holding shares as on the cut-off date i.e. September 20, 2022 may cast their vote electronically on the business as set forth in the Notice of AGM through remote e-voting during the AGM. The detailed procedure or instructions for e-voting are contained in the Notice of AGM. In this regard, the Members are hereby

- (i) The remote e-voting shall commence on Saturday, September 24, 2022 at 9.00 am (IST) and end on Monday, September 26, 2022 at 5.00 pm.
- (ii) The remote e-voting module shall be disabled by CDSL for voting after 5.00 p.m. (IST) on September 26, 2022.
- (iii) It is hereby clarified that it is not mandatory for a member to vote using the remote e-voting facility. Members have also an option to cast their vote through e-voting by attending the AGM. Members can opt for only one mode of voting. The Members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again
- iv) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date, i.e. September 20, 2022 only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM. A person, who is not a Member as on the said cut-off date, should treat this Notice or Notice of AGM for information purposes only.
- (v) Any person who has acquired shares of the Company and become member after dispatch of the Notice of AGM and holding shares as on cut-off date i.e. Tuesday, September 20, 2022 may obtain login ID and password by sending a request to the Company at cs@genuspaper com or to the RTA at nichetechpl@nichetechpl.com. However, if a person is already registered with CDSL for e-voting then existing login ID
- i) The shareholders, who are present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remoti e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM. Member participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act,
- riii) In case of any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, members may refer the Frequently Aske Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@ cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Rakesh Dalvi (022-23058542) or Mr. Mehboob Lakhani (022-23058543). All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, (CDSL,) Central
- Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022- 23058738 / 022-23058542/43. The Company has appointed Ms. Komal, Practicing Company Secretary (FCS No.11636, CP No.17597) (M/s. Komal & Associates), of Delhi, a the Scrutinizer to scrutinize the remote e-voting process prior to the AGM and e-voting during the AGM in a fair and transparent manner.
- The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Wednesday, September 21, 2022 to Tuesday, September 27, 2022 (both days inclusive) for the purpose of AGM.

By Order of the Board For Genus Paper & Boards Limited Anuj Ahluwalia

Place: Moradabad Date: September 02, 2022 GENERAL INSURANCE CORPORATION OF INDIA

Tel: +91-22-2286 7000, Fax: +91-22-2288 4010,

(A Government of India Company) Regd. Office: 'Suraksha', 170, J. Tata Road, Churchgate, Mumbai - 400 020

GIC Re

Website: www.gicofindia.com, E-mail: investors.gic@gicofindia.com CIN: L67200MH1972GOI016133, IRDAI REG. NO. 112 NOTICE OF 50th ANNUAL GENERAL MEETING

Annual General Meeting:

Notice is hereby given that the 50th Annual General Meeting (AGM) of General Insurance Corporation of India will be held on Monday, 26th September 2022 at 03:00 p.m. (IST) through Video Conferencing/Other Audio-Visual Means (OAVM) in compliance with the applicable MCA circulars and provisions of the Companies Act and SEBI Regulations (collectively referred to as Statutory Provisions) to transact the business as set out in the Notice of AGM. The proceeding of the AGM shall be deemed to be conducted at the Registered Office of the Corporation.

Notice of AGM and Annual Report:

The Notice convening the AGM and the Annual Report of the Corporation for the financial year 2021-22 have been emailed on Friday, 2nd September 2022 to Members whose registered email IDs are available with Depository Participants(DP)/Registrar and Transfer Agent (RTA). The aforesaid documents can also be accessed on the websites of the Corporation at www.gicofindia.com, Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and e-voting agency M/s. National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com

E-voting through Electronic means:

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with other applicable statutory provisions, the Corporation has engaged the services of M/s. National Securities Depository Limited ("NSDL") for provision of remote e-voting facility as under:

Particulars	Prior to AGM	During AGM	
Commencement of remote e-voting	Wednesday, 21st September 2022 [From 09:00 a.m. (IST)]	Monday, 26 th September 2022	
End of remote e-voting	Sunday, 25 th September 2022 [Till 05:00 p.m. (IST)]	Monday, 26 th September 2022 (15 minutes post end of AGM)	
Cut-off date (for eligibility to vote)	Monday, 19th September 2022		
Weblink to access	https://www.evoting.nsdl.com		
E-voting Event Number	EVEN-121687		

 A person whose name appears in the Register of Members/Beneficial Owners as on the cut-off date i.e. Monday, 19th September 2022 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the Annual General Meeting.

- 2. The Voting rights of Members shall be in proportion to the Equity shares held by them in the paid-up equity share capital of the Corporation as on 19th September 2022.
- Members who have not registered their email addresses or any person who becomes a Member of the Corporation after despatch of the Notice of the AGM but before the cut-off date for e-voting i.e. 19th September 2022 can email the request to the Corporation at investors.gic@gicofindia.com by quoting the Folio No./DP-ID Client ID for obtaining copy of the Notice and Annual Report. Such Members are requested to follow the instructions given under the notes in the Notice of AGM to obtain Login id & Password for remote e-voting.
- The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.
- The Members who shall be present in the AGM through VC/OAVM facility and have not cast their votes through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote during the AGM.
- Members who are desirous of inspecting the Statutory Registers/Documents forming part of Annual Reports can write to the Corporation on email id: cs.gic@gicofindia.com stating their DP-ID & Client ID or Folio No. upto the date of AGM.
- 7. Members who would like to ask questions during the AGM need to register themselves as a speaker by sending their requests mentioning their names, DP ID and Client ID/Folio number, and mobile number at gicagm.speakers@gicofindia.com between Monday, 19th September 2022 (09:00 a.m. IST) and Wednesday, 21st September 2022 (05:00 p.m. IST). Only those Members who have pre-registered themselves as a speaker will be allowed to express their views/ask questions during the AGM. The Corporation reserves the right to restrict the number of speakers depending on the availability of time for the AGM.
- 8. In case of queries, Members may refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and the E-Voting User Manual for Shareholders available at the download section of NSDL at www.evoting.nsdl.com. Members may also contact the following:

Toll free no.: 1800-222-990 or 1800-22-44-30 or contact Mr. Amit Vishal / Ms. Pallavi Mhatre, NSDL at the designated email IDs at evoting@nsdl.co.in

This public notice is also available on the Corporation's website (www.gicofindia.com). For General Insurance Corporation of India

Place: Mumbai (Satheesh Kumar) Dated: 02.09.2022 **Company Secretary** PSSM MEDIA LIMITED

NOTICE OF 5" ANNUAL GENERAL MEETING

egd. Office: 8-2-603 1 2, 1st Floor, Road No 10, Banjara Hills, Hyderabad, Telangana - 500 03

Notice is hereby given that the 5° Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, 29th September, 2022 at 03:00 PM at the Registered Office of the Company situated at 8-2-603/1/2, 1st Floor, Road No.10, Banjara Hills, Hyderabad, Telangana - 500 034.

Notice of the meeting setting out the business to be transacted thereat together with Audited Financial Statements for the year ended 31" March 2022, Auditors Report and the Directors Report has been sent to the members to their registered addresses electronically to those members who have registered their email addresses. The same is also available at the company's website being www.pmconlinetv.com and at the registered office of the company.

Pursuant to Section 108 of the Companies Act 2013 read with rule 20 of Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time, the company has provided e-voting facility to members to cast their vote by electronic means on all resolutions set forth in the notice.

- All business may be transacted through electronic means.
- Cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is 22" September 2022. A member whose name is recorded in the register of members or the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the remote e voting facility as well as voting
- The e-voting facility shall be available at www.evotingindia.com from Monday, 26th September 2022 (9 A.M. IST) and ends on Wednesday, 28th September 2022
- Any person, who becomes the member of the company after dispatch of the notice of the meeting and is holding share as of the cut-off date i.e., 22" September, 2022, may obtain the User ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. The detailed procedure for obtaining User ID and password is also provided in the Notice of the meeting which is available on the CDSL's website and all assistance will be provided at the registered office of the company. If the member is already registered with CDSL for e voting then he can use his existing user ID and password for casting vote through remote e-voting.
- The members who have casted their vote by remote e-voting may attend the

Voting shall be by ballot papers for members who attend the AGM and who have not

- Remote e-voting facility shall not be allowed after 28th September 2022 (5 p.m. IST).
- entitled to avail the remote e-voting facility or voting through ballot papers at AGM. Pursuant to Section 91 of the Companies Act, 2013 ("the Act") notice is further given that the Register of Members and Share Transfer books of the Company will
- In case of any queries/ grievances regarding e-voting, the Members/ Beneficial owners may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Anand Kumar Chedarla at the registered office of the company at 8-2-603/1/2, 1st Floor, Road No.10, Banjara Hills, Hyderabad, Telangana - 500 034; email:pssmmedia@gmail.com;
- The website of the company is www.pmconlinetv.com.

Date: 03.09.2022

The Board of Directors of Company has appointed Ms. Shaik Razia, or failing her, Mr. Mohit Kumar Goyal, Partners, D. Hanumanta Raju & Co Company Secretaries, as the Scrutinizers to scrutinize the remote e-voting process and voting at AGM in a fair and transparent manner. The result declared along with scrutinizer's report will be displayed on the company's website www.pmconlinetv.com within 3 days of conclusion of the AGM.

Managing Director

Formerly Known as Gopala Polyplast Limited) CIN: L25200GJ1984PLC050560

Tel: +91-79-27561000 • Email: cs@hpbl.in • Website: www.hpbl.in NOTICE OF ANNUAL GENERAL MEETING AND E-VOTING PROCEDURE

to transact the business set out in the Notice of conveying AGM.

The Annual Report along with the Notice to AGM for FY 2021-22 has been sent to the Members through e-mail on 02™ September, 2022 and are available on the website of the Stock Exchange where the shares of the company are listed i.e the BSE Limited (www.bseindia.com) and on available on the website of the company at www.hpbl.in

company will remain closed on 19" September, 2022 in terms of provisions of the act and the Listing Regulations for the purpose of

Further in compliance with the provisions of Section 108 of the Companies Act 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Act") as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice conveying the AGM using electronic voting system (e-voting) provided by National Securities Depository Limited (NSDL). The voting rights of Members shall be in proportion to their shares of the paid-up equity share capital of the

Friday, 23" September, 2022 and end at 5.00 p.m IST on Sunday, 25" September, 2022. During this period, the members may cast their vote electronically. The voting through remote e-voting shall not be allowed beyond 05.00 p.m IST on Sunday, 25" September, 2022. Those members who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting, shall be eligible to vote through e-voting system during the AGM.

The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall

Members of the company holding shares as on the cut-off date i.e

Any person become a member of the company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date may cast their votes by following the instruction and process of e-voting / remote e-voting as provided in the Notice of the AGM.

- an email to cs@hpbl.in along with necessary details like folio number Name of Member(s) and self attested scanned copy of PAN Card or Addhar Card for registering their email address.
- b) Members holding shares in Demat mode are requested to contact their respective Depository participant for registering the email addresses. For the details relating to e-voting/remote e-voting. Please refer to the Notice of the AGM. In case of any queries, you may refer the Frequently

Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no: 1800-1020-990 and 1800 22 44 30 or send a reques to at evoting@nsdl.co.in.

mode for any technical issues related to login through Depository i.e NSDL and CDSL.

holding securities in demat mode with NSDL	contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30	
Individual Shareholders holding securities in demat mode with CDSL	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 or 022-23058542-43	

Helpdesk details

Login type

Individual Shareholders

Place: Ahmedabad

Date: 03/09/2022

Sd/

Company Secretary Ahmedabad

Dipesh Panchal



Date: 03" September, 2022

acent to Topaz Building, Hyderabad-500082, Telangana, India. Phone. 040-23420422 to 2 Website: www.vijayadiagnostic.com, Email: in@vijayadiagnostic.in

("Kfintech") at www.evoting.kfintech.com

The detailed procedure and instructions for joining the e-AGM, remote e-voting and

End of remote e-voting 5:00 p.m. on Tuesday, September 27, 2022

subsequently or cast the vote again Company after dispatch of the Notice and holding shares as of cut-off date, may obtain the login id and password by following the process as indicated in the

For Members who have not registered their email address, the Annual Report, Notice

In case of any query on e-voting, Members may refer to the "Help" and "FAQs"

no. 1-800-309-4001 (toll free). The final dividend as recommended by the Board, if approved at the ensuing AGM,

For Vijaya Diagnostic Centre Limited

Anusha Kanumuru **Company Secretary**

Balmer Lawrie Investments Ltd. (A Government of India Enterprise)

Registered Office: 21, Netaji Subhas Road, Kolkata - 700 001

CIN: L65999WB2001GOI093759

Telephone No: 033 22225227 Email: lahoti.a@balmerlawrie.com Website: www.blinv.com

AND E-VOTING INFORMATION The 21" Annual General Meeting (AGM) of the Members of Balmer Lawrie Investments Ltd. ("the Company") will be held on Tuesday, 27" September, 2022 at 04:00 P.M. through Two - way Video Conferencing ("VC") or Other Audio-Visual Means ("OAVM") without the physical attendance of Members, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the allied Rules made thereunder, read with General Circular Nos. 14/2020 dated 8" April, 2020, 17/2020 dated 13" April, 2020, 20/2020 dated 5" May, 2020 & 2/2022 dated 5" May, 2022 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") in

this regard (collectively referred to as "MCA Circulars") to transact the businesses set out in the notice calling

NOTICE OF THE 21" ANNUAL GENERAL MEETING (AGM)

The Notice of the AGM and Annual Report for the Financial Year 2021-22 has been sent on Friday, 2" September, 2022 to shareholders holding the shares of the Company as on the cut-off date i.e. Friday, 19" August, 2022 (end of day) in the prescribed mode as per Securities and Exchange Board of India Circular bearing reference no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022. The Notice and the Annual Report are also available on the website of the Company at https://www.balmerlawrie.com/blinv/ annualreports.php, on the website of the Stock Exchanges where the Equity Shares of the Company are listed i.e. www.bseindia.com and www.cse-india.com and on the website of National Securities Depositories Limited ("NSDL") (agency for providing the VC/OAVM and e-voting facility) at www.evoting.nsdl.com.

The Company is providing to its Members the facility to exercise their right to vote on resolutions proposed to be passed at AGM by electronic means ("e-voting"). Members may cast their votes remotely, using the electronic voting system of NSDL on the dates mentioned herein below ("remote e-voting"). Further, the facility for voting through electronic voting system will also be made available during the AGM and members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM. The

detailed instructions regarding attending AGM and e-voting is provided in the notice of the AGM.

The remote e-voting facility will be available during the following voting period:

to avail the facility of remote e-voting or e-voting during the AGM.

Commencement of remote e-voting: Friday, 23" September, 2022 at 09:00 A.M. End of remote e-voting: Monday, 26th September, 2022 at 05:00 P.M. A person whose name is recorded in the register of Members or in the register of beneficial owners maintained

by the depositories as on the cut-off date i.e. Tuesday, 20" September, 2022 (end of day) only shall be entitled

The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by NSDL upon expiry of the aforesaid period. Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e., Tuesday, 20th September, 2022 (end of day), may cast their vote electronically.

the Company can cast their vote through remote e-voting or through the e-voting system provided during the AGM as per the instructions contained in the aforesaid notice of the AGM. The Members of the Company who holds shares in physical form and have not registered their e-mail addresses with the Company are requested to contact M/s. C. B. Management Services Private Limited, Unit

The Members who are holding shares in physical form or who have not registered their e-mail addresses with

Balmer Lawrie Investments Limited, the Registrar & Share Transfer Agent (RTA) of the Company at the below mentioned details for registering their e-mail addresses:

the AGM through voting by electronic means.

- P-22, Bondel Road, Kolkata-700019
- Phone Number-033 40116700, iii. e-mail: rta@cbmsl.com

A Member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting. Any person, who have acquired shares and becomes a Member of the Company after the dispatch of the

Notice and holding shares as on cut-off date i.e. Tuesday, 20" September, 2022 (end of day) may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote. Contact details: In case of any query/grievance with respect to e-voting, Members may refer to Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for shareholders available under the

download section of NSDL's e-voting website www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990

and 1800 22 44 30 or send a request to Ms. Pallavi Mhatre, Manager at evoting@nsdl.co.in, address - Trade

World, Awing, 4" Floor, Kamala Mills Compound, Lower Parel, Mumbai - 400013 The Register of Members and the Share Transfer Books of the Company shall remain closed from Wednesday, 21" September, 2022 to Tuesday, 27" September, 2022 (both days inclusive). Upon declaration by the Members, dividend for the Financial Year 2021-22 shall be paid to those shareholders

who are holding shares of the Company as on the cut-off date i.e., Tuesday, 20th September, 2022 (end of day)

within the statutory time limit of 30 days from the date of such declaration. Ms. Binita Pandey, Partner of M/s. T. Chatterjee & Associates, Practicing Company Secretaries (Membership No. A41594 & CP No. 19730) has been appointed to act as a scrutinizer for the e-voting process to ensure that the same is conducted in a fair and transparent manner.

> **Abhishek Lahoti Company Secretary** ACS 25141

For Balmer Lawrie Investments Limited



Sd/

through ballot papers at AGM.

- (5 P.M. IST). Thereafter, the portal will be disabled.
- meeting but shall not be entitled to cast their vote again.
- casted votes on resolutions set out in the notice electronically. A member whose name is recorded in the register of members or the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be
- remain closed from Thursday, 22" September, 2022 to Thursday, 29" September 2022 (both days inclusive) for the 5" AGM.
- Ph.No: 040-29880145.

For PSSM Media Limited

HCP PLASTENE BULKPACK LIMITED Registered Office: H.B. Jirawala House, Navbharat Soc., Nr. Panchshil Bus Stand, Usmanpura Ahmedabad Gujarat-380013

NOTICE is hereby given that the 38" Annual General Meeting ("AGM" of the Members of HCP Plastene Bulkpack Limited ("Company") will be held on Monday, 26th September, 2022 at 11.00 AM, through Video Conferencing ("VC")/other Audio Visual Means ("OAVM"), in compliance with all the applicable provisions of the Company Act, 2013 and the Rules made thereunder and the securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 read with all the applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI")

The Members can attend and participate in the AGM through VC/OAVM only. Detailed instructions for joining the AGM will be provided in the Notice of AGM. Members attending the meeting through VC / OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013

the website of the National Securities Depository Limited (www.nseindia.com) ("NSDL") (www.evoting.nsdl.com). The same is also The Register of Members and the Share Transfer Books of the

company as on Monday, 19" September, 2022 ("cut-off date"). The remote e-voting period shall commence at 9.00 a.m. IST on

not be entitled to cast their votes again. Monday, 19" September, 2022 may cast their votes.

In case Member(s) have not registered their e-mail address, they may follow the following instructions Members holding shares in the Physical mode are requested to send

Helpdesk for individual Shareholders holding securities in demat

	For HCD Disetone Bulknack Limi	
Individual Shareholders holding securities in demat mode with CDSL	Members facing any technical issue in login ca contact CDSL helpdesk by sending a request at helpdesk evoting @ cdslindia.com or contact at 022-23058738 or 022-23058542-43	
demat mode with NSDL	at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30	

Members facing any technical issue in login can

INDO TECH

INDO-TECH TRANSFORMERS LIMITED

CIN: L29113TN1992PLC022011 Regd. Office : Survey No. 153-210, Illuppapattu Village, Near Rajakulam, Kancheepuram (Dist.) Tamilnadu - 631561. Tel: +91 44 27281854 Email: investor@indo-tech.com: Website: www.indo-tech.com

30[™] ANNUAL GENERAL MEETING OF THE COMPANY

Members are requested to note that the 30th Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, the 29" day of September 2022 at 10:30 A.M. Indian Standard Time (IST) through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), to transact the businesses as set out in the Notice, which will be circulated for convening the Annual General Meeting.

In compliance with the General Circular No. 2/2022 dated May 5, 2022 read with General circular No. 02/2021 dated January 13, 2021, General circular No. 20/2020 dated May 05, 2020, General circular No. 17/2020 dated April 13, 2020 and General circular No. 14/2020 dated April 08, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA"), and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 read with Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI") and other applicable provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the Company shall be held through VC or OAVM without the physical presence of the Members at a common venue. In compliance with the General Circular No. 2/2022 dated May 5, 2022 read

The Notice of the AGM along with the Annual Report 2021-22 will be sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company/ Depositories. However, the company shall send hard copy of annual report to those shareholders who request for the same. Members may note that the Notice and Annual Report 2021-22 will also be a more as with the Notice and Annual Report 2021-22 will state the Notice and Annual Report 2021-22 will state the Notice and Annual Report 2021-20 will state the Notice and Notice and Notice sanie. Meniloes nay note nat the Notice and Amilian Report 2021-22 will also be made available on the Company's website www.indo-tech.com, websites of the Stock Exchanges i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Link Intime India Private Limited at instavote.linkintime.co.in. Members can attend and participate in the Annual Central Modifications (MCOMM facility and the Company MCOMM facility and the Company facility and the Company facility and the Company facility and the Company facil General Meeting through VC/OAVM facility only.

Members who have not registered their e-mail addresses so far are requested to register the same in respect of shares held in dematerialized form with the Depository through their Depository Participants ("DP") and in respect of shares held in physical form by writing to the Registra & Share Transfer Agent ("RTA") — Link Intime India Private Limited on their email id enotices@linkintime.co.in.

The Company will provide the facility to its Members to exercise their right to vote by electronic means both through remote e-voting and e-voting at the Annual General Meeting to its Members. The detailed instructions on the process of e-voting, including the manner in which Members holding shares in physical form or who have not registered their email addresses can cas their vote through e-voting, will be provided as part of the Notice of the 30" Annual General Meeting.

By order of the Board of Directors
For INDO-TECH TRANSFORMERS LIMITED

Date: September 02, 2022 Place : Kancheepurar

Manikandan M Company Secretary

કેમીસન્થ (વાપી) લિમિટેડ રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં. ૨૫, જી.આઇ.ડી.સી., વાપી, ગુજરાત – ૩૯૬૧૯૫, ભારત ક્ષેન: + ૯૧ ૨૬૦ ૨૪૩૨૮૮૫ ફેક્સ : + ૯૧ ૨૬૦ ૨૪૩૨૦૩૬ – CIX: L24110611986#L008634

૩૬ મી વાર્ષિક સામાન્ય સભા, બુક બંધ અને ઈલેક્ટ્રોનિક મતદાન માહિતી નોટીસ આથી સુચના આપવામાં આવે છે કે કેમીસિન્થ (વાપી) લિમિટેડના સભ્યોની ૩૬ મી વાર્ષિક સામાન્ય સભા બુધવાર, ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે રજિસ્ટર્ડ ઓફિસ પ્લોટ નં ૨७, જી.આઈ.ડી.સી., વાપી જિ. વલસાઠ, ગુજરાત ખાતે યોજવામાં આવશે જ્યાં નોટીસ માં દર્શવિલ વ્યવસાયો લેવક્ટેવક કરવા આવશે.

એજીએમ નોટિસ અને નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨ નું કંપનીનું વાર્ષિક અહેવાલ મેઈલ દ્વારા રવાના કરવામાં આવી છે જેમની મેઈલ આઈડી કિપોઝીટરી પાર્ટિસિપન્ટ (ઓ) / કંપની પાસે નોંધાવેલ છે. અન્ય સભ્યો ને કુરીઅર દ્વારા નોટીસ અને અફેવાલ મોકલવામાં આવી છે.

આથી વધુ સૂચના આપવામાં આવે છે કે કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૯૧ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર જરૂરીયાતો) રેગ્યુલેશન્સ ૨૦૧૫ ના નિયમ ૪૨ અનુસાર સભ્યો નું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ ૨૨ મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૨૮ મી સપ્ટેમ્બર ૧૦૨૨ (બંને દિવસ સહિત) સુધી વાર્ષિક સભા હેતુ માટે બંધ રહેશે.

ાંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્કલોઝ જરૂરીચાતો) રેગ્યુલેશન્સ ૨૦૧૫ ના નિચમ ૪૪, કંપની ઈલેક્ટ્રોનિક વોર્ટીંગ સિસ્ટમની સુવિધા આપી રહી છે. સભ્યો એજીએમ સ્થળ કરતા અન્ય કોઈ પણ સ્થળે થી ઈલેક્ટ્રોનીક વોટીંગ સિસ્ટમ દ્વારા મત આપી શકે છે. કંપનીએ સભ્યો માટે ઈ-વોર્ટીંગ પ્લેટકોર્મ પૂંરુ પાડવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) સાથે કરાર કર્યો છે.

કંપનીઓ (સંચાલન અને વહીવટ) નિયમો ૨૦૧૪ (સુધારેલ) ના નિયમ ૨૦ મુજબ કંપની આથી જાણ કરે છે કે:

૧. એજીએમ નોટિસ માં દર્શાવેલ બધા વ્યવસાયો દૂરસ્થ ઈલેકટ્રોનિક મતદાન દ્વારા વ્યવહાર કરી શકે છે.

૨. આ દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન ૨૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨, ૧૧:૦૦ વાગ્યે થી શરૂ થશે અને ૨૯ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે અંત થશે. આ તારીખ અને સમય બાદ દૂરસ્થ ઈલેક્ટ્રોનિક વોર્ટિંગ ને મંજૂરી આપવામાં આવશે નહિ.

3. સભ્યો નો મતદાન અધિકાર ૨૧ મી સપ્ટેમ્બર ૨૦૨૨ (કટ ઓફ તારીખ) ના રોજ તેમના કંપનીની ભરપાઈ થયેલી ઈક્વિટી શેર મૂકી માલિકી પ્રમાણમાં રહેશે. જે કોઈ પણ વ્યક્તિ નોટીસ મોકલાયા પછી કંપનીનો સભ્ય બની જાય છે અને કટ ઓફ તારીખ પર શેર માલિકી ધરાવે. એ દૂરસ્થ ઇલેકટ્રોનિક મતદાન માટે લોગીન અને પાસવર્ડ evoting@nsdl.co.in કે

compliance@chemeisynth.com à support@purvashare.com. ч વિનંતી મોકલીને મેળવી શકે છે.

૪. વાર્ષિક સામાન્ય સભામાં પેપર દ્વારા મત આપવાની સુવિધા આપવામાં આવશે. પરંતુ જેમણે દૂરસ્થ ઈલેક્ટ્રોનિક મતદાન દ્વારા મતદાન કર્યું હશે તે પેપર દ્વારા વાર્ષિક સામાન્ય સભામા મત

પ. દુરસ્થ ઈલેક્ટ્રોનિક મતદાન દ્વારા કે અસેંટ /ડિસેંટ ફોર્મ દ્વારા કે વાર્ષિક સામાન્ય સભામા પેપર દ્ધારા મત આપવા માટે ચોગ્થતા નક્કી કરવા માટે કટ ઓફ તારીખ ૨૧ મી સપ્ટેમ્બર ૨૦૨૨ છે.

૬. સભ્ય દુરસ્થ ઈલેક્ટ્રોનિક મતદાન દ્વારા મત કર્યા બાદ પણ વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લઇ શકે છે પરંતુ તેમને વાર્ષિક સામાન્ય સભામાં મત આપવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.

છ. જે વ્યક્તિનું નામ સભ્ય રજિસ્ટરમાં કે ડિપોઝિટરીઓ દ્વારા જાળવવામાં આવતા બેનેફિસિયલ રજિસ્ટરમાં કટ ઓફ તારીખે (૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૨) નોંધાયેલ એજ દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન દ્વારા કે અસેંટ/કિસેંટ ફોર્મ દ્વારા કે વાર્ષિક સામાન્ય સભામાં મતદાન સુવિધા મેળવવ ફકદાર રહેશે.

૮. એજીએમ નોટિસ કંપનીની વેબસાઈટ (www.chemiesynth.com) પર અને એનએસડીએલની વેબસાઈટ (www.evoting.nsdl.com) પર પ્રદર્શિત કરી છે. અને સ્ટોક એક્ષચેન્જની વેબસાઈટ પર (www.bseindia.com/)

દરસ્થ ઈલેટોનિક મતદાનને લાગતા કોઈપણ કોઈ પ્રશ્નો /કરિયાદ માટે તમે કીક્વેંટલી આસ્કડ કવેશન કે ઈ-વોર્ટીંગ ચૂઝર મેન્યૂઅલ જે https://www.evoting.nsdi.com ન કાઉનલોક સેંક્શન માં ઉપલબ્ધ છે એનો સંદર્ભ લઈ શકો છો અથવા શ્રી રાજીવ રાજન નો સંપર્ક કરો. (સરિતા મોટે, એનએસડીએલ, ૪થો માળ, 'એ' વિંગ, ટ્રેડ વર્લ્ડ, કમલા મિલ કમ્પાઉન્ડ લોઅર પરેલ, મુંબઈ ૪૦૦ ૦૧૩, ઈ–મેલ આઈડી : evoting@nsdl.co.in, ટેલિફોન નંબર લાઅર પરલ, મુખ્ય ૧૦૦૦ રા... ૧૨૨–૨૪૯૯ ૪७૩૮ અથવા ટોલ ફી નં. ૧૮૦૦ ૨૨૨૯૯૦) કેમીસિન્થ (વાપી) લિમિટેક વતી

તારીખ : ૦૨ જી સપ્ટેમ્બર, ૨૦૨૨ સ્થળ : વાપી

સ્થળ : અમદાવાદ.

સંદીપ ઝવેરી, મેનેજીંગ કાથરેક્ટર DIN: 00142205

૬,ગ્રાઉન્ડ ફ્લોર, નારાયણ ચેમ્બર્સ, પતંગ હોટલ પાછળ, આશ્રમરોડ,

📶 માસ ફાઇનાન્સિયલ સવિસીસ લિમિટેડ

અमहावाह-३८०००६. होन : ०७६-४९९०५५००/७३३

बैंक ऑफ़ इंडिया Bank of India

Head Office, Information Technology Department, Star House-2, 8th floor, C-4, G-Block Bandra-Kurla Complex, Bandra (E), Mumbai-400051.E-mail: Headoffice.it@bankofindia.co.

REQUEST FOR PROPOSAL FOR PROCUREMENT, INSTALL ATION, COMMISSIONING AND MAINTENANCE OF SECOND MPLS LINKS AND EMPANELMENT OF VENDORS FOR DOMESTIC BRANCHES / DFFICES vide Ref no. BOI/HO/IT/MPLS/RFP- 01/2022 Date 01.09.202:

The captioned RFP is available on Bank's corporate website www.bankofindia.co.in under "Tender" section since 01.09.2022 Subsequent changes if any, will henceforth be uploaded only on the website. The last date of submission: 30-09-2022



એયસીપી પ્લાસ્ટીન બલ્કપેક લિમિટેડ

(અગાઉ ગોપાલા પોલિપ્લાસ્ટ લિમિટેડ તરીકે જાણીતી) CIN: L25200GJ1984PLC050560 ાગ: Lડેટ્રેટ્ટેઇંગ્રિસ એય.બી.જીરાવાલા હાઉસ, નવભારત સોસાયટી, પંચશીલ બસ સ્ટેન્ડ પાસે, ઉસ્માનપુરા અમદાવાદ, ગુજરાત- 380013

ટેલિફોન: +91-79-27561000 • ઈ-મેઈલ: cs@hpbl.in • વેબસાઈટ: ww વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગ પ્રક્રિયાની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપની એક્ટ, 2013 અને તે પછી નનાવાયેલા નિયમો તથા સિક્યુરિટીઝ એન્ડ એક્સયેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ), નિયમો, 2015 અને કંપની બાબતોના મંત્રાલય (એમસીએ) અને સિક્યુરિટીઝ એન્ડ એક્સયેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા આ મામલે જારી કરાયેલા સાથે વંચાણે લેવાનારા લાગુ પડતાં તમામ પરિપત્રોના અનુપાલન ફેઠળ એચસીપી પ્લાસ્ટેન બલ્કપેક લિમિટેડ (કંપની)ની 38મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022ના રોજ એજીએમની નોટિસમાં દર્શાવાયેલા કામકાજ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ/ અન્ય દશ્ય- શ્રાવ્ય માધ્યમથી યોજાશે.

સભ્યો ફક્ત વીડિયો કોન્ફરન્સિંગ/ અન્ય દૃશ્ય- શ્રાવ્ય માધ્યમ દ્રારા એજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે. એજીએમમાં જોડાવા માટેની વિગતવાર સ્ચનાઓ એજીએમની સ્ચનામાં આપવામાં આવશે. કંપની અધિનિયમ, 2013 ની કલમ 103 ફેઠળ કોરમની ગણતરીના ફેતુ માટે વીડિયો કોન્ફરન્સિંગ/ અન્ય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

નાણાકીય વર્ષ 2021-22 માટે એજીએમને નોટિસ સાથેનો વાર્ષિક અફેવાલ 02 સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સભ્યોને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવ્યો છે અને તે સ્ટોક એક્સચેંજની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ્યાં કંપનીના શેર સ્ચિબદ્ધ છે એટલે કે બીએસઈ લિમિટેડ ("http://www.bseindia.com") અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("http://www.nseindia.com") ("એનએસડીએલ") (www.evoting.nsdl.com) ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તે vww.hpbl.in પર કંપનીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

એજીએમના હેતુ માટે અધિનિયમ અને લિસ્ટિંગ રેગ્યુલેશન્સની જોગવાઈઓના સંદર્ભમાં 19મી સપ્ટેમ્બર, 2022ના રોજ કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર

કંપનીઝ એક્ટ 2013ની કલમ 108ની જોગવાઈઓ અને સાથે વંચાણે લેવાનારા કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમ, 2014(કાયદો) તથા સેબીના નિયમ 44 (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યલેશન્સ 2015ના અનુપાલન હેઠળ સભ્યોને એજીએમ બોલાવવાની નોટિસમાં દર્શાવાચેલા તમામ ઠરાવો અંગે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા ઉપલબ્ધ બનાવાચેલી ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઈ-વોટિંગ)ના માધ્યમથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. સભ્યોનો મતદાનનો અધિકાર સોમવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ("કટ-ઓફ ડેટ") સુધી કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના તેમના શેરના પ્રમાણમાં રહેશે.

રિમોટ ઇ-વોટિંગનો સમયગાળો શુક્રવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૯:૦૦. વાગ્યે શરૂ થાય છે અને રવિવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ ભારતીય સમયાનુસાર સાંજે ૫.૦૦ વાગ્યે સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકે છે. રિમોટ ઈ-વોટિંગના માધ્યમથી સાંજે 5.00 કલાક પછી મતદાનની મંજૂરી અપાશે નહીં. જે સભ્યો વીસી/ઓએવીએમ સુવિધા મારફતે એજીએમમાં ઉપસ્થિત રહેશે અને જેમણે રિમોટ ઇ-વોટિંગ મારફતે ઠરાવો પર પોતાનો મત આપ્યો ન હતો, તેઓ એજીએમ દરમિયાન ઇ-વોટિંગ સિસ્ટમ મારફતે મતદાન કરવા માટે પાત્ર બનશે.

જે સભ્યોએ એજીએમ પૂર્વે રિમોટ ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે. તેઓ વીસી/ઓએવીએમ મારફતે એજીએમમાં પણ ફાજરી આપી શકે છે/તેમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેઓ ફરીથી મતદાન કરવા માટે હકદાર રહેશે નહીં.

કોઈ પણ વ્યક્તિ કે જેઓ કંપની દ્વારા ઈલેક્ટ્રોનિક માધ્યમથી નોટિસ જારી કરાયાં બાદ કંપનીના શેર ખરીદી સભ્ય બન્યા હોય અને નિર્દિષ્ટ કટ-ઓફ ડેટના રોજ કંપનીના શેર ધરાવતા હોય તેઓ એજીએમની નોટિસમાં અપાયેલી ઇ-વોટિંગની સ્ચનાઓ અને પ્રક્રિયાને અનુસરીને પોતાનો મત આપી શકે છે.

જો સભ્ય(ઓ) એ તેમના ઈ-મેઈલ એડ્રેસની નોંધણી કરાવી ન હોય, તો તેઓ નીચેની સૂચનાઓનું પાલન કરી શકે છે.

(એ) ફિઝિકલ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને તેમના ઇમેઇલ એડ્રેસની નોંધણી માટે સભ્ય(સભ્યો)નો ક્રેલિયો નંબર તથા પાન અથવા આધાર કાર્ડની સ્વપ્રમાણિત સ્ક્રેન નકલ સહિતની જરૂરી વિગતો સાથે "cs@hpbl.in" પર ઇમેઇલ મોકલવા વિનંતી કરવામાં આવે છે.

(બી)ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યોને ઇમેઇલ સરનામાંની નોંધણી માટે તેમના સંબંધિત ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

ઇ-વોટિંગ/રિમોટ ઇ-વોટિંગને લગતી વિગતો માટે કૃપા કરીને એજીએમની નોટિસ જુઓ. કોઈ પણ પૂછપરછ કરવા માટે, તમે www.evoting.nsdl.com ડાઉનલોડ સેક્શન પર ઉપલબ્ધ શેરધારકો માટેના ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચિયન્સ (FAQs) અને શેરધારકો માટેના ઇ-વોટિંગ યુઝર મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર: 1800-1020-990 અને 1800 22 44 30 પર વિનંતી મોકલી શકો છો અથવા 'evoting@nsdl.co.in" પર વિનંતી મોકલી શકો છો.

ડિમેટ સ્વરૂપે શેર ધરાવતા વ્યક્તિગત શેરધારકોની એનએસડીએલ કે સીડીએસએલ પૈકીની ડિપોઝિટરીઝમાં લોગિન અંગેની કોઈ પણ ટેકનિકલ સમસ્યા માટેના હેલ્પડેસ્કઃ

લોગિનનો પ્રકાર	ફેલ્પડેસ્કની વિગતો
એનએસડીએલમાં	લોગિનમાં કોઈ પણ ટેકનિકલ સમસ્યાનો સામનો કરી
લ્યક્તિગત શેરહોલ્ડરો	રફેલા સભ્યો "evoting@nsdl.co.in" પર વિનંતી મોકલીને એનએસડીએલ ફેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર: 1800 1020 990 અને 1800 22 44 30 પર કોલ કરી શકે છે.
સી.ડી.એસ.એલ. સાથે	લોગિનમાં કોઈ પણ ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રફેલા

વિનંતી મોકલીને સીડીએસએલ ફેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે સિક્યરિટીઝ ધરાવતા <mark>અથવા 022-23058738 અથવા 022-23058542-43</mark> વ્યક્તિગત શેરફોલ્ડરો પર સંપર્ક કરી શકે છે. એચસીપી પ્લાસ્ટીન બલ્કપેક લિમિટેડ માટે,

સભ્યો "helpdesk.evoting@cdslindia.com" પર

વતી, માસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ

દિપેશ પંચાલ સ્થળ : અમદાવાદ કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર

डजिश नोटिस (સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૮(૧) (સ્થાવર મિલકત માટે-અમૂલ્ય મિલકત માટે)

આથી, નીચે સહી કરનાર તે **માસ ફાઇનાન્સિચલ સર્વિસીસ લિમિટેડ** ના ઓથોરાઈઝ્ડ અધિકારીએ ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨નો ઓર્ડર ૫૪) અને કાયદા તળેની સેક્શન ૧૩ (૧૨) સાથે ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ -૩ મુજબ મળેલ પાવર્સ મુજબ નીચે મુજબના કરજદાર / સહ-કરજદાર / જામીનદારને તા. ૧૯-૦૫-૨૦૨ રના રોજ નોટિસ આપેલી અને તે નોટીસમાં જણાવેલ રકમ નોટીસ મળ્યાથી દિન ૬૦માં ચુકવવા જણાવેલ.

ડિમેટ મોડમાં

કરજદાર આ રકમ ચૂકવવામાં અસમર્થ રહેલ છે, જેથી સદર કરજદાર / સહ-કરજદાર / જામીનદાર અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે સામાન્ય રીતે મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે થતા કોઈ પણ સોદાની તા. ૧૯-૦૫-૨૦૨૨ લેણી થતા તેની પરના વ્યાજ ની રકમ માટે **માસ ફાઇનાલ્સિચલ સર્વિસીસ લિમિટેડ** ના ચાર્જમાં ગણાશે. અમો નીચે સહી કરનારે નીચે દર્શાવેલી મિલ્કતોનો **તા. ૦૧-૦૯-૨૦૨૨ ના રોજ** સાંકેતિક કબજો સેક્શન ૧ ૩ના સબસેક્શન (૪) સાથે રૂલ- ૮ તળે મળેલ સત્તાની રૂએ મેળવેલ છે.

કરજદાર/સહ કરજદાર / જામીનદાર નું ધ્યાન દોરવામાં આવે છે કે, સદર કાયદાની કલમ ૧ ૩ની સબ-સેક્શન (૮) મુજબ સદર મિલ્કતની પુનઃ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ સમયમાં કલેઈમ કરી શકે છે.

કરજદાર/સહ-કરજદાર/જામીનદારનાં નામ	સ્થાવર મિલકતનું વર્ણન	લોન એકાઉન્ટ નં પઝેશનની તારીખ	બાકી નીકળતી લેણી રકમ (જે ડિમાન્ડ નોટિસમાં જણાવ્યા પ્રમાણે
મેસર્સ એમેરાલ્ડ લક્ઝરી કાર્સ એલએલપી,	જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ સબ ડિસ્ટ્રીકટ અમદાવાદ-૬		તા. ૧૬-૦૫-૨૦૨૨
તેના ભાગીદાર હારા -	(નરોડા) ખાતે આવેલ મોજે દરીયાપુર-કાઝીપુર તા.	૨૮૧૪૯૩૨ અને	ના રોજ બાકી
શ્રી કનેયો મનહરકુમાર ઠક્કર (અરજદાર)	અસારવા, જી. અમદાવાદ ખાતે આવેલ બીન ખેતીની જમીન	2648633	३।.१,१૯,३५,५०२
મેસર્સ એમેરાલ્ડ કાર્સ પ્રા. લિમિટેડ તેના ડિરેક્ટર દ્વારા - શ્રી કનેચો મનહરકુમાર ઠક્કર (સહ-અરજદાર અને જામીનદાર)	પર આવેલ સ્કીમ ''આમ્રકુંજ''ના ફલેટ નં. ૧૦૨, પહેલો માળ, (હોલો પ્લીન્થ ઉપર) કે જેનું સુપર બીલ્ટઅપ એરીયા ૩૩૫ ચો.વાર યાને ૨૮૦.૧૦ ચો.મી. આશરે,	09-0G- 2 022	(અંકે રૂપિયા એક કરોડ ઓગણીસ લાખ પાંત્રીસ હજાર છસો બે પુરા)
શ્રીમતી ખુશી કનેચો ઠક્કર (સહ-અરજદાર અને ભાગીદાર અને જામીનદાર)	વણવહેંચાયેલ હિસ્સો ૭૧.૯૩ ચો.મી. સહિત બિલ્ડીંગની નીચે અને બિલ્ડીંગની નીચે આખા ભોંયરા સાથે કે જેનું		લોન એકાઉન્ટ નં. No.2814932 માટે અને
શ્રી રૂપેશ દિનેશભાઈ જંગાણીયા (સહ-અરજદાર અને કીરેક્ટર અને જામીનદાર)	ક્ષેત્રફળ ૪૪૨.૫૬ ચો.મી. (સમગ્ર ભોંયરૂં સામાન્ય દાદર અને લિફટના વિસ્તાર સિવાય) સામાન્ય ભાગોના પ્રમાણસર હક્ક હિસ્સા સહિત, ફાઈનલ પ્લોટ નં. ૧૯૮ (રેવન્યુ સર્વે નં. ૧૬૬ના સબ પ્લોટ નં. એ ના બદલામાં ફાળવેલ) સીટી સર્વે રેકોર્ડના પ્રમોલગેશન બાદ શાહીબાગ વોર્ડના સીટી સર્વે નં. ૫૯૧૨ અને ફાળવેલ ૯૮૬.૫૦ ચો.મી. આશરે ૧૧૮૦ ચો.વાર) ટીપી નંબર-૧૪ પર આવેલ છે. તેવી મિલકત.		અન તા. ૧ દ-૦૫-૨૦૨૨ ત્તા રોજ બાકી રૂા.૧,૧૯,૩૫,૬૦૨ (અંકે રૂપિયા એક કરોડ ઓગણીસ લાખ પાંત્રીસ હજાર છસો બે પુરા) લોન એકાઉન્ટ નં. No.2814933 માટે

Deep Polymers Limited

CIN: L25209GJ2005PLC046757 Registered Office: Block No. 727 & 553, Rakanpur (Santej) Taluka: Kalol, Gandhinagar - 382 721, Gujarat. | Phone: 091 - 98250 35472

Email: cs.deeppolymers@gmail.com | Website: www.deeppoly.com

NOTICE OF THE 17™ ANNUAL GENERAL MEETING OF THE COMPANY, BOOK CLOSURE AND E-VOTING

- The 17th Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Saturday, 24th September, 2022 at 1.00 P.M. through Video Conferencing (VC) / Other Audio Video Means (OAVM) to transact the ordinary and special businesses as set out in the notice of AGM.
- As per SEBI Circular dated 12th May, 2020, Physical Copy of the Annual Report for the 17th AGM inter-alia is not required to be sent; therefore Annual Report is being sent only through electronic mode to those Members as on 26th August, 2022, whose email addresses are registered with the Company / Depositories. Members whose E-mail id is not registered / updated can register / update their e-mail address.
- The Notice of 17th AGM and Annual Report for Financial Year 2021-22 will also be made available on the Company's website at www.earumpharma.com, website of stock exchange i.e. BSE Limited at www.bseindia.com
- Notice is hereby further given that pursuant to Section 91 of the Companies Act. 2013 read with rules made thereunder and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the register of Members and Share Transfer Book of the Company will remain closed from Saturday, 17th September, 2022 to Saturday, 24th September, 2022 (both days inclusive) for purpose of 17th Annual General
- As per Section 108 of the Companies Act, 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and clause 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide the members the facility to cast their votes electronically from a place other than the venue of the AGM (remote E-voting) on all resolutions set forth in the Notice, for which the Company has engaged the services of National Securities Depository Limited as the E-voting agency. All the members are informed that;
- A. The Ordinary Business as set out in the notice of AGM may be transacted through voting by electronic means.
- B. The remote e-voting shall commence on 21st September, 2022 at 09:00 A.M. & shall end on 23rd September, 2024 at 05:00 P.M.
- C. The cut-off date for determining the eligibility to vote by electronic means or at AGM is Saturday, 17th September, 2022.
- D. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date i.e Saturday, 17th September, 2022, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote.
- E. Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) E-voting facility shall be available after AGM for those who have not voted; c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting.

The company has appointed M/s. Gaurav Bachani & Associates as the Scrutinizer to scrutinize the E-voting process in fair and transparent manner. Any Query or grievance connected with the remote e-voting may be addressed to the Company Secretary of the Company at E-mail cs.deeppolymers@gmail.com or

you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote evoting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 for any further clarification. For, Deep Polymers Limited

Place: Gandhinagar Date: 2nd September, 2022 Rameshbhai Patel Managing Director DIN: 01718102

નેપબુક્સ લિમિટેડ

CIN: L72900GJ2017PLC096975 **રજિસ્ટર્ડ ઓફિસ:** 3rd ફ્લોર. બીસનેસ બ્રોડવે સેંટર, નિયર લો ગાર્ડન, અમદાવાદ- 380006, ગુજરાત. • **ટેલિફ્રોનઃ** 079-48940505 વેબસાઈટ: www.naapbooks.com • ઈ-મેલ: compliance@naapbooks.com

કંપનીની 5મી વાર્ષિક સામાન્ય સભા, કટ-ઓફ તારીખ અને ઈ- મતદાનની સૂચના

<mark>ખાથી નોટિસ જાહેર કરવામાં આવે છે કે કંપનીની 5 મી વાર્ષિક સામાન્ય સભા</mark> એજીએમ ની નોટિસ માં દર્શાવેલ કામગીરી માટે **બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ** બપોરે 04:00 કલાકે વિડીચો કોન્ફરન્સિંગ (વીસી) અથવા અધર ઓડિયો વિઝયુઅલ મીન્સ (ઓએવીએમ) ના માધ્યમથી સભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વગર યોજાશે. 5 મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસની કોપી કંપનીની વેબસાઈટ https://www.naapbooks.com/wp-content/uploads/2022/09/AGM-Notice-2022.pdf યને https://www.naapbooks.com/wp-content/uploads/2022/09/Annual-Report-2022.pdf મૂકી દેવામા આવેલ છે.

5 મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસની કોપી અને વાર્ષિક અહેવાલની કોપી કંપનીના બધા સભ્યોને તેમના મેઈલ આઈડી કે જે કંપની/ડિપોઝિટરી પાસે નોંધાયેલ છે તેના પર મોકલી દેવામાં આવેલ છે. જે સભ્યોના મેઈલ આઈડી કંપની/ડિપોઝિટરી પાસે નોંધાયેલા ના હોઈ તો તેવા સભ્યો તેમના મેઈલ આઈડી ની વિગત કંપની ની મેઈલ આઈડી compliance@naapbooks.com પર મોકલી આપે કે જેથી તે સભ્યોને પણ નોટિસ અને વાર્ષિક અઠેવાલની કોપી મોકલી શકાય. 5 મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ ની કોપી તથા વાર્ષિક અફેવાલ 2021-22 ની કોપી કંપનીની વેબસાઈટ https://www.naapbooks.com/wp-content/uploads/2022/09/AGM-Notice-2022.pdf খন https://www.naapbooks.com/wp-content/uploads/2022/09/Annual-Report-2022.pdf પર મૂકી દેવામા આવેલ છે.

સુધારેલા કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટેશન) નિયમ, 2014 ના નિયમ 20 ની ર્સાથે વંચાણે લેનારા કંપનીઝ એક્ટ, 2013 ની કલમ 108 તથા સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન, 2015 ના નિયમ 44 ના અનુપાલન અંતર્ગત તમામ સભ્યોને **NSDL દ્વારા** ઉપલબ્ધ બનાવાયેલી ઇલેક્ટ્રોનિક વોંટિંગ સિસ્ટમ દ્વારા એજીએમની નોટિસમા ઉલ્લેખિત તમામ ઠરાવો પર રિમોટ ઈ-વોટિંગની સુવિધા ઉપલબ્ધ બનાવાયી છે. રિમોટ ઈ -વોટિંગનો સમય રવિવાર, 25 સપ્ટેમ્બર, 2022 (સવારે 09.00 કલાકે) શરૂ થઇ મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2022 (સાંજે 05.00 કલાકે) પૂર્ણ થશે.

તમામ સભ્યોને આ સાથે જણાવવામાં આવે છે કે: 1. 5 મી વાર્ષિક સામાન્ય સંભાની નોટિસ મા ઉલ્લેખિત તમામ ઠરાવો પર રિમોટ ઈ-

- વોટિંગથી વોટિંગ થશે.
- 5 મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ તથા વાર્ષિક અફેવાલ 2021-22 ની કોપી ની વહેંચણી તારીખ 02/09/2022 ના રોજ પૂર્ણ કરેલ છે.
- રિમોટ ઈ-વોટિંગ નો સમય 25/09/2022 (સવારે 09.00 કલાકે) શરુ થઇ 27/09/2022 (સાંજે 05.00 કલાકે) પૂર્ણ થશે.
- સભ્યો નો મતદાન નો અધિકાર તેમની પાસે 22/09/2022 (કટ-ઓક ડેટ) ના દિવસે કંપનીના ઇક્વિટી શેરના પ્રમાણમા રહેશે.
- NSDL દ્વારા ઈ- વોટિંગની સુવિધા 27/09/2022 ને સાંજે 05.00 વાગ્યા પછી બંધ કરી દેવા મા આવશે. ત્યાર પછી સભ્યો ઈ-મતદાન કરી શકશે નિહ.
- જો કોઈ સભ્ય કંપની દ્વારા વાર્ષિક અફેવાલની વહેંચણી કરયા પછી કટ- ઓફ ડેટ ના દિવસે કંપની ના સભ્ય બને છે તો તેઓ એ evoting@nsdl.co.in પર વિનંતી મોકલી ઈ –મતદાન માટે ના જરૂરી યુસર આઈડી અને પાસ્વર્ડ મેળવી લેવા પરંતુ જો, એ સભ્યો પાસે પહેલેથી જ ઈ-મતદાન માટે ના જરૂરી યુસર આઈડી અને પાસ્વર્ડ છે. તો એ જ યુસર આઈડી અને પાસ્વર્ડનો ઈ-મતદાન (ઇ- વોટિંગ) માટે ઉપયોગ કરવો.
- જો કોઈ સભ્યએ રિમોટ ઈ –મતદાન દ્વારા પહેલેથી જ વોટિંગ કરેલ હશે તો તે સભ્ય સામાન્ય સભામાં ભાગ લઇ શકાશે પરંતુ સભા યાલુ હોઈ ત્યારે વોટિંગ કરી શકાશે નહિ

ઈ –મેઈલ આઈડી અપડેટ કરવા બાબતે:

જનરલ સરક્યુલર નં. 20/2020 તારીખ 05/05/2020 અને જનરલ સરક્યુલર નં 02/2021 તારીખ 13/01/2021 MCA દ્વારા જાહેર કરવામા આવેલ ના સંદર્ભમા, કંપની 5 મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ, વાર્ષિક અફેવાલ અને બીજા કોઈપણ પ્રકારની માહિતી આપતા દસ્તાવેજો સભ્યોને કંપની/ ડિપોઝિટરી પાસે નોંધાયેલ ઈ-મેઈલઆઈડી પરજ મોકલી શકાશે એવો ઉલ્લેખ કરવામા આવેલ છે. જે સભ્યોના ઈ-મેઈલ આઈડી કે બેંક ખાતાની વિગત કંપની/ડિપોઝિટરી પાસે નોંધાયેલ નથી તેવા સભ્યોએ પોતાની ઈ –મેઈલ આઈડી compliance@naapbooks.com અને CC મા einward.ris@kfintech.com પર ઈ –મેઇલ કરી દેવો.

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને એજીએમ અને હોલ્ડિંગ નોટિસ મોકલ્યા પછી કેમ્પેનીના સભ્ય બને છે અને કટ ઓફ ડેટ i.e ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2022 ના રોજ કંપની ના શેર પાસે છે તો તેઓ એ એજીએમ ની નોટિસ માં જણાવેલ ઈ વોટિંગ ની પ્રોસેસ મારફતે પોતાની યુઝર આઈ ડી અને પાસવર્ડ મેળવી લેવો.

ઈ -વોટિંગ માટે કોઈપણ પ્રશ્નો હોઈ તો તેવા શેરધારકો માટે વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs) અને ઈ -વોટિંગ મેનુઅલ ડાવનલોડ સેકશન www. evoting.nsdl.com પર શેરધારકો માટે અવેલેબલ છે અથવા શેરધારકો ટોલ ફ્રી નંબર:- 1800-222-990 પર કોલ કરી શકે છે અથવા તેમની વિનંતી evoting@nsdl.co.in અને શેરધારકો શ્રીમાન સાહ્લ જોટાણીયા , કંપની સચિવ તેમની રજસ્ટર્ડ ઓફિસ પર સંપર્ક કરી શકે છે અર્થવા ઇમેઇલ આઈડી compliance@naapbooks.com પર પોતાની વિનંતિ મોકલો શકે છે અથવા 9016323227 પર કોલ કરી શકે છે.

સભ્યો ફક્ત VC/0AVM સુવિધા દ્વારા વાર્ષિક સભામા ભાગ લઇ શકશે. વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સંચના 5 મી વાર્ષિક સામાન્ય સભામાં આપવામાં આવેલ છે. જો કોઈ સભ્યને 5 મી વાર્ષિક સામાન્ય સભામા ભાગ લેવા સબંધિત કોઈ પ્રશ્ન અથવા સમસ્યા હોઈ તો તમે evoting@nsdl.co.in પર ઈ –મેઈલ કરી શકો છો અથવા ટોલ ફ્રી નં. 1800222990 પર ફોન કરી શકો છો. VC/OAVM દ્વારા એજીએમ મા ભાગ લેનારા સભ્યોની ગણતરી કંપની ધારો, 2013 ની કલમ 103 ની ફેઠળ ક્વોરમની ગણતરી ના હેતુ માટે કરવામા આવશે. ફ્રોર, નેપબુકસ લિમિટેડ

સ્થળ: અમદાવાદ તારીખ: 03/09/2022

વ્હોલ ટાઈમ ડિરેક્ટર અને સીએફઓ (ડીન: 07773205)

Sd/-

થમન સલુજા

કેઆઇએફએસ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડ



૨૪)સ્ટર્ડ ઓફીસ : બી-૮૧, પરિસીમા કોમ્પલેક્ષ, સી. જી. રોડ, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦ ૦૬, ગુજરાત, ઇન્ડિયા. CIN: L67990GJ1995PLC025234;

इोन: +६१ ७६ २६४००१४०, ७४० ઇમેઇલ: cs@kifs.co.in. વેબસાઇટ: www.kifsfinance.com

૨૭મી વાર્ષિક સામાન્ય સભા, બુક ક્લોઝર અને ઇ-વોટિંગની જાહેર સુચના

આથી સુચના આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૨૭મી વાર્ષિક સામાન્ય સભા મંગળવા૨, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સાંજે ૪.૦૦ વાગે વિડિયો કોન્ફરન્સિંગ (વીસી) અથવા અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો દ્વારા, કંપનીસ એક્ટ, ૨૦૧૩ અને એમસીએ દ્વારા રજુ કરેલ પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧ અને ૧૨/૨૦૨૧ તેમના તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, ૧૩મી એપ્રિલ ૨૦૨૦, પમી મે, ૨૦૨૦, ૧૩મી જાન્યુઆરી ૨૦૨૧ અને િક્સેમ્બર ૧૪, ૨૦૨૧ ના રોજ અનુક્રમે અને સેબી દ્વારા ૧૨મી મે ૨૦૨૦ અને ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રજૂ કરાયેલ પરિપત્રો ને અનુસરીને મતલબ કે કોઈ સામાન્ય સ્થળે સભ્યોની સારિરીક હાજરી વીના કરવાના આવશે.

કંપનીએ — સુધી વાર્ષિક અહેવાલ ૨૭મી સામાન્ય સભાની નોટિસ સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તે તમામ સભ્યોને મોકલી છે જેમના ઇ–મેઇલ આઇડી કંપની / આરટીએ / ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ સાથે નોંધાયેલા છે.

સામાન્ય સભા બોલાવતી સૂચના સાથે વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.kifsfinance.com. સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com અને એનએસડીએલની વેબસાઈટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે.

રિમોટ ઇ-વોટિંગનો સમયગાળો શનિવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ વાગે શરૂ થાશે જે સોમવાર, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ વાગે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન અને સામાન્ય સભા દરમિયાન સભ્યો તેમના મત ઇલેક્ટ્રોનીક રીતે આપી શકે છે. ત્યાર બાદ NSDL દ્વારા રિમોટ ઇ-વોટિંગની સુવિધા બંધ કરી દેવામાં આવશે.

જે સભ્યો ડીમેટ મોડમાં, ફિઝીકલ મોડમા શેર ધરાવે છે અને જેમના ઇ–મેઇલ આઇડી કંપની સાથે ૨જીસ્ટર્ડ નથી તેમના માટે સામાન્ય સભાના રિમોટ ઇ-વોટિંગ અને મતદાન કરવાની રીત ૨૭મી સામાન્ય સભાની સચનામાં આપી છે અને ડિવિડંડ સિધ્ધા બેંક ખાતામાં મેળવવાના પગલાં પણ સભાની સૂચનામાં આપેલ છે.

જે સભ્યોએ નોટિસનો ઇમેઇલ મોકલ્યા પછી શેર ખરીદ્યા હશે તેઓ રિમોટ ઇ-વોટિંગ દ્વારા તેમના મતનો ઉપયોગ કરવા અને વીસી દ્વારા સભામાં હાજરી આપવા માટે સભાની સચનામાં આપેલા પગલાઓનો સંદર્ભ લઇ શકે છે. જે સભ્યો રિમોટ ઇ-વોટિંગ દ્વારા મતદાન કરે છે તે સભામાં હાજરી આપી શકશે પરંતુ ફરીથી મત કરી શકશે નહીં.

જે શેર હોલ્ડર્સ એ એમાનો ઇ-મેઇલ કંપની પાસે રજીસ્ટર નથી કરાવ્યો તેમને વિનંતી છે કે કંપની દ્વારા આગળની સુચના મેઇલમાં પ્રાપ્ત કરવા માટે નીચેના પગલાનું પાલન કરે :

૧) શારીરિક ક્રોલ્ડિંગ માટે	સભ્યનું નામ અને સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઇલ આઇડી, પાનકાર્ડની સ્વ- પ્રમાણિક નકલ, અને કોઈપણ દસ્તાવેજની સ્વ.પ્રમાણિત નકલ (દા.ત. ડ્રાઈવિંગ લાઇસન્સ, ચૂંટણી ઓળખકાર્ડ, પાસપોર્ટ) સભ્યના સરનામાંના સમર્થનમાં ઉક્ષેખ કરતો સહી કરેલ વિનંતી પત્ર cs@kifs.co.in અને ahmedabad@linkintime.co.in પર ઇ-મેઇલ દ્વારા મોકલો.	
(૨) ડીમેટ ક્રોલ્ડિંગ માટે	પ્રાધાન્ય તમારા ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધણી કરાવો અથવા ઉપરના દસ્તાવેજો + સ્વ. પ્રમાણિત ડીપી આઇડી અને ક્લાઇંટ માસ્ટર અને કોન્સોલીડેટેડ સ્ટેટમેન્ટ cs@kifs.co.in અને ahmedabad@linkintime.co.in પર ઇ મેઇલ દ્વારા મોકલો.	

સભ્યો ઇ-વોટિંગ માટેના લોગીન અને પાસવર્ડ મેળવવા માટેની અરજી ઉપર જણાવેલ દસ્તાવેજો સાથે એનએસડીએલને તેના ઇમેલ આઈડી evoting@nsdl.co.in પર કરી શકે છે. લાગુ પડતી જોગવાઈઓને અનુસરીને જો સભામાં ડિવિડેડ જાહેર થાય તો તે આપવા માટે અને રિમોર્ટ ઇ-વોટિંગની સુવિધા અને સભામાં વીસી દ્વારા હાજર રહેવા માટે એવા શેર હોલ્ડર્સને જ અનુમતી આપવામાં આવશે જે કટ ઓફ તારીખ મંગળવાર, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૨ના રોજ શેરહોલ્ડર્સ હશે. અને આ હેતુ માટે રજીસ્ટર ઓફ મેમ્બર અને શેર ટ્રાસફર બુક્સ બુધવાર, ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨થી મંગળવાર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (બંને દિવસના સમાવેશ કરીને) બંધ રહેશે. જે સભ્યોને સભા પહેલા અથવા સભા દરમિયાન ઇ-વોટિંગ માટે સહાયતા જરૂર હોય તેઓ NSDL ને evoting@nsdl.co.in અથવા ૧૮૦૦-૨૨૨-૯૯૦ પર અથવા શ્રી અમીત વિશાલ. સિનિયર મેનેજરને amitv@nsdl.co.in પર અથવા ૦૨૨-૨૪૯૯૪૩૬૦ અથવા +૯૧ ૯૯૨૦૨૬૭૮૧૪૬૭૫૨અથવા ૦૨૨-૨૪૯૯૪૫૫૩૫૨અથવા +૯૧ ૯૩૨૬૭૮૮૧૪૬૭ પર સંપર્ક કરી શકે છે.

કેઆઇએફએસ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડ કંપની વતી, રાજેશપી. ખાંડવાલા, મેનેજિંગ ડિરેક્ટર, DIN: 00477673, અમદાવાદ, પમી સપ્ટેમ્બર, ૨૦૨૨

Pnb पंजाब नेशनल बेंक U punjab national bank SASTRA DIVISION, 3rd FLOOR, EAST WING, PLOT NO. 4, SEC. 10, DWARKA NEW DELHI

ORDER OF THE COMMITTEE FOR IDENTIFICATION OF WILFUL DEFAULTERS PASSED

IN PROCEEDINGS CONDUCTED AT SYNDICATE ROOM, HEAD OFFICE ON 25.05.2022 M/s. Mahip Industries Ltd. (Rs. 27.78 Cr) CS/ZS: Ahmedabad

Date of NPA: 30.01.2020

n terms of RBI Master Circular no. DBR. No. CID.BC.22/20.16.003/15-16 dated July 01.2015, neeting of the Committee for Identification of Wilful Defaulters of the Bank was held on 23.07.2021 The Identification Committee concluded that events of wilful default in the Borrower's account(s had occurred and gave its approval for issuance of Show Cause notice for identifying the following erson(s) as wilful defaulters:

M/s. Mahip Industries Limited (Borrower) Sh. Raieev Agarwal (Director & Guarantor)

Sh.Radheshyam Oza (Director & Guarantor) Sh. Ramesh Baghel (Director & Guarantor) M/s. Arnay Fibres Private Limited (Corporate Guarantor)

on 09 08 2021 to the above Borrower i ordingly Show Cause notice of 15 days was iss M/s. Mahip Industries Ltd and its above noted directors/guarantor responsible for managing the affairs of the Borrower who were found involved in the events of default. They were informed, if they so desire, they can make a representation to the Bank within 15 days from receipt of notice, as twhy they be not classified as wilful defaulter. Pursuant to the SCN dated 09.08.2021, representation vas received from M/s. Mahip Industries Ltd (Borrower) & M/s Arnav Fibres Pvt Ltd (Corporate Guarantor). The Identification Committee in its meeting held on 12.11.2021, after due consideration of facts on record observed that the Borrower, Director(s) and Guarantor(s) have defaulted in payment/repayment obligations to the Bank and as such are fit to be identified as Wilful Defaulters Order of the Committee for Identification of Wilful Defaulter dated 17.11.2021 was issued. I esponse to the said order, M/s. Mahip Industries Ltd (Borrower) & M/s Arnav Fibres Pvt Ltd (Corporate Guarantor) represented vide letter dated 15.12.2021.

n compliance to the direction of the Review Committee in its meeting dated 29.04.2022, notice was issued to borrower its directors/ guarantors to appear before the Identification Committee fo personal hearing scheduled on 25.05.2022. However, the parties failed to attend personal hearing. Deliberation of the committee

Upon perusal of the representation received and material on record, the committee observed that ZSC Ahmedabad after re-examining the available facts & records has vide letter dated 17.02.2022 recommended to drop the said charges of "Siphoning of Funds" being one of the reason for identifying the account as Wilful Defaulter. The committee observed that in view of the above, the present proceedings **may be continued only on the grounds of capacity to pay.**The committee also noted that the Borrower & Guarantor(s)/ Corporate Guarantor are claiming thei

right on compensation amount of Rs.21.29 Cr which was received from NHAI due to acquisition o one IP mortgaged with Bank wherein the proceeds should have rightfully been credited to Borrowe account. The committee also noted that the guarantors have initiated various litigations before DR1 and Hon'ble High Court of Gujarat against the bank's recovery action which show the deliberate intent of the borrower/ quarantor in not paying the dues of the bank. The committee also observed that the borrowers/ guarantors have not provided any documentary

charge of capacity to pay in the SCN is based on the Audited balance sheet of the corporate guarantor and the Confidential Report of the guarantors which is prepared on the basis of inputs eceived from the parties. The committee noted that the net means of Sh. Baieev Agarwal as ne bank's record is Rs 15.28 crores. The committee took note of the fact that the borrower has beer admitted in NCLT on 24.04.2022. The committee noted that the net means of Sh. Radhey Shyam Oza and Sh. Ramesh Baghel as pe CR is Rs 0.09 crores and 0.03 crores which is almost negligible as compared to the dues of the

evidence to show that they do not have the capacity to pay the bank's dues. On the other hand, the

bank. The committee also noted that ZRC Ahmedabad vide letter dated 17.02.2022 has recommended to drop the proceedings against Sh. Ramesh Baghel. In view of the same the committee observed that the willful default proceedings against Sh. Radhey Shyam Oza and Sh. Ramesh Baghel be dropped on the grounds of capacity to pay. Hence, the committee concluded that this is a fit case where the borrower and its directors uarantors i.e M/s Mahip Industries Ltd, Sh. Rajeev Agarwal (Director/ Guarantor) and M/s Arnay Fibres Private Limited (Corporate quarantor) who are involved in the events of default, are

Master Circular of RBI: As per ABS as on 31.03.2016 & CR dated 20.09.2017 the borrower and guarantors have net means

liable to be identified as wilful defaulters on the following ground(s) specified in above mentioner

ay but they are not paying the Bank dues. Net Worth of the Borrower & Guarantors are as:			
Name	NM (In Cr)	IP (In Cr)	
M/s. Arnav Fibers Private Limited.	0.20	0.29	
Sh. Rajeev Govindram Agarwal	15.28	11.30	
Sh.Radheshyam Oza	0.09	NIL	
Sh. Ramesh Baghel	0.03	NIL	
Total	15.60	11.59	

ORDER OF THE COMMITTEE FOR IDENTIFICATION OF WILFUL DEFAULTERS:

The Identification Committee, headed by the Executive Director and consisting of other members i.e. Chief General Managers and Dy. General Manager of the Bank, after due consideration of the representation/reply submitted by the borrower found that the charges against the Borrower and its above named Directors/ Guarantors stand proved for the reasons and facts stated above. herefore, the said Committee recorded the fact of wilful default committed by M/s Mahin dustries Ltd, Sh. Rajeev Agarwal (Director/ Guarantor) and M/s Arnav Fibres Private Limited (Corporate guarantor) and identified them as "Wilful Defaulters", for the cogent reasons

The committee further decided to drop the willful default proceedings against Sh. Radhey Shyam Oza(director/guarantor) and Sh. Ramesh Baghel (director/guarantor) in view of the

The Committee also decided to drop the charges of "Siphoning of Funds" being one of the reason for identifying the account as Wilful Defaulter.

lowever, the Committee members directed that the borrower and above named Directors Guarantors are free to make a written representation against the order of identification Committee within a period of 15 days from the date of receipt of this order to the Review Committee headed by the MD & CEO of the Bank at the following address: Punjab National Bank, SASTRA Division, Corporate Office, 3rd Floor, Plot No.4, Sector 10, Dwarka, New Delhi, PIN: 110075. This order supersedes the earlier order dated 17.11.2021.

The undersigned is the member of the Identification Committee constituted in consonance with the

RBI directives and the Identification Committee has authorized the undersigned to send this **ORDER OF THE COMMITTEE FOR IDENTIFICATION OF WILFUL DEFAULTERS** under his signature.

Sd/- (Ashok Kumar Mishra) Member of Identification Committee